

ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીસ્ટન્સ એજ્યુકેશન, આણંદ

આણંદ કૃષિ યુનિવર્સિટી

આણંદ

ડીપ્લોમા ઇન એગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન ફોર ઇનપુટ ડીલર્સનો સમાપન-વ-પ્રમાણપત્ર  
વિતરણ કાર્યક્રમ

સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષના વડપણ હેઠળ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડીસ્ટન્સ એજ્યુકેશન યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત ખેતીની વિવિધ ઇનપુટ વેચાણ કરતા એગ્રો ઇનપુટ ડીલર્સ માટેનો ડીપ્લોમા અભ્યાસક્રમ ૨૦૧૫- જુનમાં શરૂ થયો હતો. આ અભ્યાસક્રમ ચાલુ સાલે પુર્ણ થતાં તેનો સમાપન-વ-પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ માનનીય કુલપતિશ્રી ડૉ.એન.સી.પટેલના અધ્યક્ષતાને તા.૨.૬.૨૦૧૬ ના રોજ રાધાકિષ્ક્રાંત હોલ, ડેરી વિજ્ઞાન ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ડીસ્ટન્સ એજ્યુકેશનના નિયામક ડૉ.પ્રદિપકુમાર ભટ્ટે સ્વાગત કર્યું હતું. કુલપતિશ્રી ડૉ.એન.સી.પટેલે સર્વે ડીલરોને આર્શીવચન પાઠવી બીરદાવ્યા હતા અને ખેડૂતોની નિષ્ઠાપૂર્વક સેવા બજાવવા અપીલ કરી હતી. સદર કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોમાં મુખ્ય મહેમાન તરીકે સંશોધન નિયામક અને અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ, ડૉ.કે.બી.કથીરીયા, અતિથિ વિશેષ તરીકે વિસ્તરણ શિક્ષણ નિયામક, ડૉ.પી.પી.પટેલ, તથા કુલસચિવ ડૉ.એમ.એન.બ્રહ્મદે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના ડીન, અભ્યાસક્રમમાં ઇનપુટ ડીલરોને જ્ઞાન પિરસનાર વિવિધ શિક્ષણ તેમજ સંશોધન વિભાગોના અધ્યાપકો તેમજ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને ઇનપુટ ડીલરના સહયોગથી તૈયાર કરાયેલ પ્રગતીશીલ ખેડૂતોની સફળવાર્તા, એગ્રો ઇનપુટ ડીલરની ડીરેક્ટરી અને ગ્લોહરી ઓફ " ડીપ્લોમા ઇન એગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વીસીસ ફોર ઇનપુટ ડીલર્સ " અંગેની પુસ્તીલકાઓનું મહાનુભવોના હસ્તો વિમોચન કરવામાં આવેલ.

વિશેષમાં ૪૫ ઇનપુટ ડીલરોને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેઓના વરદહસ્તે વિશિષ્ટ યોગ્યતા એવોર્ડ તેમજ ડીપ્લોમા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત નવા પ્રવેશ મેળવેલ ૪૫ એગ્રો ઇનપુટ ડીલરોને આવકારવામાં આવ્યા હતા. તદઉપરાંત ઇનપુટ ડીલરોએ " ડીપ્લોમા ઇન એગ્રીકલ્ચરલ એક્ષ્ટેન્શન સર્વીસીસ ફોર ઇનપુટ ડીલર્સ " ના અભ્યાસક્રમ સબબ મીઠા અનુભવોને પ્રતિભાવોને પણ રજૂ કર્યા હતા.

કાર્યક્રમના અંતે ડીલર અંકુરભાઈ પટેલે સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોજનાના મદદનીશ પ્રાધ્યાપિકા અને સહ કોઓર્ડીનેટર ડૉ.શ્રીમતી મીનાબેન પટેલે કર્યું હતું.

